

ત્વરિત જાહેરાત માટે

બ્રેમ્પટન રિજનલ કાઉન્સિલર રોવેના સેન્ટોસ FCM બોર્ડમાં પુનઃ ચૂંટાયા.

બ્રેમ્પટન, ઓન્ટારિયો (04 જૂન 2021) – ફેડરેશન ઓફ કૅનેડિયન મ્યુનિસિપાલિટીઝ (FCM)ની આજની વાર્ષિક સામાન્ય સભામાં જાહેર કરવામાં આવ્યું છે કે બ્રેમ્પટન રિજનલ કાઉન્સિલર રોવેના સેન્ટોસ FCM બોર્ડના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં એક વર્ષની અવધિ માટે ફરી 2021-2022 ના સત્રમાં ચૂંટાયા છે.

1901થી FCM કૅનેડાના સુધારાઈ પ્રશાસનનો રાષ્ટ્રીય અવાજ રહ્યો છે. તેમાં આખા રાષ્ટ્રની 2,000 સુધારાઈઓ સભ્યપદ ધરાવે છે જે તમામ કૅનેડાવાસીઓનું 90% પ્રતિનિધિત્વ કરે છે. આ કોન્ફરન્સ જે આ વર્ષે વર્ચ્યુઅલ માધ્યમથી 31 મી મે થી જુન 4થી સુધી હાથ ધરાઈ તેમાં સીટી ઓફ બ્રેમ્પટનને અગત્યના મુદ્દાઓ અંગે FCM નીતિ બનાવવાની તક સાંપડી તેમજ નીચેના મુદ્દાઓ અંગે ફેડરલ સરકાર પાસેથી સમર્થન અને ભંડોળ માટે હિમાયત કરી શક્યા:

- ટ્રાન્ઝિટ કામગીરીઓ માટે ભંડોળ સહિત સેફ રિસ્ટાર્ટ અગ્રીમેન્ટ (Safe Restart Agreement) ના ઉત્તરાધિકારી કરાર પરનું કાર્ય;
- આંતર પ્રાદેશિક, ઉચ્ચ કોટિના ટ્રાન્ઝિટ નેટવર્ક માટે પ્રતિબદ્ધતા;
- સક્રિય પરિવહન માળખા અને કાર્યક્રમોનો અમલ કરવા માટે ટકાઉ નિધિયન;
- આબોહવા પરિવર્તન અનુકૂલન અને સ્થિતિસ્થાપકતા ઉન્નત કરવા માટે રોકાણ અને નીતિમાં ફેરફારો; અને
- આર્થિક વિકાસ અને રિકવરીમાં નિવેશ જેમકે રોજર્સ સાયબરસિક્યોર કેટેલિસ્ટ (Rogers Cybersecure Catalyst)માં રોકાણ.

સિટીના હિમાયત પ્રયાસો અંગે વધુ માહિતી અહીં મળી રહેશે [સિટી ઓફ બ્રેમ્પટનની વેબસાઈટ](#).

FCM બોર્ડ ઓફ ડિરેક્ટર્સની ચૂંટણી વર્ચ્યુઅલ માધ્યમથી 31મી મેથી 4થી જુન સુધી હાથ ધરવામાં આવી હતી જેને આજે FCMની વાર્ષિક સામાન્ય સભામાં બહાલી આપવામાં આવી.

સુવાક્યો

"આખા દેશની સુધારાઈઓના આગેવાનોની ટીમ સાથે હજુ બીજા સત્રમાં સેવા આપવી તે ગૌરવની વાત છે. FCM ખાતે અમે અમારી બધી જ ભાગીદારીઓ વધુ મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ અને હું આપણી આર્થિક રિકવરી અને આબોહવા પરિવર્તનના લક્ષ્યો સહિત બ્રેમ્પટનના નિવાસીઓ માટેની અગત્યની અગ્રિમતાઓની હિમાયત કરવી ચાલુ રાખીશ. દેશની સુધારાઈઓ એટલેકે મ્યુનિસિપાલિટીઓનું પ્રતિનિધિત્વ કરતા આગળ પડતા જૂથ તરીકે FCM COVID-19 મહામારીને કારણે નાણાકીય કટોકટીનો સામનો કરતી સુધારાઈઓને ફેડરલ નિધિયન સંપાદિત કરવામાં સફળ રહ્યું છે અને સમકક્ષ પ્રોવિંશલ ભંડોળ મેળવવા માટે અસોસિએશન ઓફ મ્યુનિસિપાલિટીઝ ઓફ ઓન્ટારિયો (AMO) અને ઓન્ટારિયોઝ બિગ સિટી મેયર્સ (OBCM) સાથે કાર્યરત રહ્યા છે. સાથે મળીને અમે આપણા સ્થાનિક સમુદાયોની જબરદસ્ત સ્થિતિસ્થાપકતાને વધાવી લઈએ છીએ. અમે તે શોધ ચાલુ રાખીશું કે આપણા શહેરો અને નિવાસીઓએ મહામારી વચ્ચે આગળ કેમ વધવું જેથી ઉજ્જવળ ભવિષ્યને આવકારી શકાય."

- રોવેના સેન્ટોસ રિજનલ કાઉન્સિલર, વોર્ડ 1 અને 5, સીટી ઓફ બ્રેમ્પટન

"બ્રમ્પટન સીટી કાઉન્સિલ વતી મને ગૌરવ છે કાઉન્સિલર સેન્ટોસ આ હોદ્દા પર આપણા શહેરને સેવા પ્રદાન કરવા ચૂંટાઈ આવ્યા જેથી તે કામને વેગ મળે જે કાઉન્સિલ કરી રહી છે જેનાથી સુનિશ્ચિત થાય કે બ્રમ્પટનને પબ્લિક ટ્રાન્સિટ માટેના ભંડોળનો ન્યાયી હિસ્સો પ્રાપ્ત થાય, સક્રિય પરિવહન નેટવર્ક, COVID-19 મહામારીનો રિકવરી સપોર્ટ મળે અને બીજા કોઈપણ મુદ્દાઓ જે બ્રમ્પટનના રહેવાસીઓ માટે મહત્વપૂર્ણ હોય. મને પૂરેપૂરો વિશ્વાસ છે કે રોવેનાનો ઉત્સાહ અને પ્રતિબદ્ધતા ચોક્કસ જ સુનિશ્ચિત કરશે કે સિટી ઓફ બ્રમ્પટનના તેમજ રિજન ઓફ પીલના આપણા નિવાસીઓનો અવાજ સાંભળવામાં આવશે અને તેનાથી અસરકારક રીતે પરિણામો પ્રાપ્ત થશે."

- પેટ્રિક બ્રાઉન, મેયર, સીટી ઓફ બ્રમ્પટન

-30-

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રમ્પટનમાં 7,00,000 કરતા વધુ લોકો વસે છે અને તેમાં 75,000 વ્યવસાયો છે. અમે જે કંઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતી યાત્રાનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર જોડાવ. વધુ જાણવા માટે www.brampton.ca.

મિડિયા સંપર્ક :

મોનિકા દુગ્ગલ (Monika Duggal)

કોઓર્ડિનેટર, મિડિયા એન્ડ કમ્યુનિટી એંગેજમેન્ટ

વ્યૂહાત્મક સંવાદ (Strategic Communication)

સીટી ઓફ બ્રમ્પટન

905-874-3426 | Monika.Duggal@brampton.ca